

કિલ્લવળ ભારત

વર્ષ

સિદ્ધિઓ અને પહેલ


વીજળી, કોલસો અને નવીન તથા પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય
ભારત સરકાર

મે 2016



અમર્યાદિત મહત્વાકાંક્ષાઓ સાથે નવી ઊંચાઈઓ સર કરતા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની દૂરદર્શિતા દ્વારા જે ઉજ્જવળ ભારતની કલ્પના કરી હતી, તેને પરિપૂર્ણ કરતી વિક્રમસર્જક સિદ્ધિઓ.




1

DISCOMs ની કાયાપલટ કરવા માટે વીજ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી વ્યાપક સુધારણા યોજના, ઉજ્જવળ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (ઉદય)




2

ઉદય બોન્ડની
₹ 1 લાખ કરોડની ફાળવણી




3

અગાઉ વીજળીથી વંચિત 7,108 ગામડાઓમાં 2015-16માં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું, જે અગાઉનાં 3 વર્ષોની સરખામણી એ 37% વધુ છે



4

વર્તમાન પ્રણાલીગત વીજ ક્ષમતામાં 2014 થી 2016 દરમિયાન પાંચમાં ભાગ (46,543 મેગા વૉટ) જેટલી વૃદ્ધિ થવા પામી



5

2012-2014માં 46 ckm ની સરખામણીએ 2014-16 નાં બે વર્ષનાં સમયગાળામાં 69 ckm પ્રતિદિન પ્રમાણે ટ્રાન્સમિશન લાઇન્સ નાખવામાં આવી



6

2008-09માં 11.1% જેટલી ઊર્જાની ઘટ હતી, એ 2015-16 માં ઘટીને માત્ર 2.1% સુધી પહોંચી ગઈ




7

74 કોલસાનાં બ્લોકસની પારદર્શક રીતે હરાજી તથા ફાળવણી થકી બધાંજ કોલસા ધરાવતાં રાજ્યોને ખાણનાં જીવનકાળ દરમિયાન ₹ 3.44 લાખ કરોડની સંભવિત આવક



8

2014-16નાં બે વર્ષનાં સમયગાળા દરમિયાન 7.4 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરીને કોલસાનાં ઉત્પાદન ક્ષેત્રે કોલ ઇન્ડિયાએ મેળવેલ સર્વોચ્ચ વૃદ્ધિ



9

2014થી સૌરઊર્જાની ક્ષમતામાં 4,132 મેગા વૉટ નો 157% જેટલો વધારો



10

2015-16માં પવન ઊર્જા ક્ષમતામાં અત્યાર સુધીનો સર્વોચ્ચ ગણી શકાય, તેટલો 3,423 મેગા વૉટનો ઉમેરો



11

2015-16માં ઉજલા હેઠળ 9 કરોડ થી વધુ એલઈડી બલ્બ્સ નું વિતરણ, જે 2013-14 નાં 6 લાખની સરખામણી એ 150 ગણું વધારે છે



12

2015-16માં અત્યાર સુધીનાં સૌથી વધુ 31,472 સૌર પંપ સ્થાપિત કરવામાં આવ્યાં, જે 1991માં જ્યારથી આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો, ત્યારથી અત્યાર સુધીમાંનાં સ્થાપિત પંપોની કુલ સંખ્યા કરતાં પણ વધુ છે



13

વધુ પારદર્શકતા લાવવા તથા જવાબદારીને વધુ સારી રીતે નિભાવવા માટે મોબાઈલ એપ્લિકેશન

ગ્રામીણ વીજળીકરણનું પગેરું લેવા માટે ગર્વ(GARV) એપ્લિકેશન વાસ્તવિક ધોરણે વીજળી નો દર તથા તેની ઉપલબ્ધતા પર દેખરેખ રાખવા માટે વિદ્યુત પ્રવાહ એપ્લિકેશન

બધાને પોસાય તેવી LEDs માટેની ઉજ્જત જ્યોતિ (UJALA)

એલ.ઇ.ડી. નાં વિતરણ પર દેખરેખ રાખવા માટે ઉજલા એપ્લિકેશન

24x7 વીજળી પરવડી શકે તેવો
પર્યાવરણને અનુકુળ

2019 સુધીમાં બધાં સુધી વીજળી પહોંચાડવા

ઘ્યેય

જેઓ જોડાયેલાં નથી, તેમને જોડવા

બધા માટે વીજળી 24x7

પરવડી શકે તેવું

પર્યાવરણને અનુકુળ

જેઓ જોડાયેલાં નથી, તેમને જોડવા

1 એપ્રિલ, 2015 મુજબ જે
18,452
ગામડાઓ વીજળીથી વંચિત
હતા, ત્યાં વીજળી
પહોંચાડવાનો પડકાર

“હવે ‘ટીમ ઇન્ડિયા’ નાં 125 કરોડ દેશવાસીઓ ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞા લે છે કે
આ 18,500 ગામડાઓમાં વીજળીનાં થાંભલાઓ, વીજ વાયરો તથા વીજળી
પૂરી પાડવાનું લક્ષ્ય અગામી 1000 દિવસોમાં સિદ્ધ કરવામાં આવશે.”

— માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી,
15 ઓગસ્ટ, 2015 નાં દિવસે

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
(DDUGJY) હેઠળ લેવામાં આવેલાં પગલાં

2,800નાં પ્રારંભિક લક્ષ્યાંક ની સામે વર્ષ 2015-16માં
7,108 ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં
આવી

40%

ગામડાઓ
તો અત્યાર સુધીમાં
જોડાઈ પણ ચુક્યા છે.





ગર્વ

ગ્રામીણ વીજળીકરણ પર નજર રાખવા

પારદર્શિતા લાવવા માટેનાં સતત પ્રયત્નો

ગ્રામીણ વીજળીકરણ પર દેખરેખ રાખવાનાં ઉદ્દેશ્યથી નાગરિકો માટે ગર્વ - (GARV) એપ્લિકેશન તૈયાર કરવામાં આવી

www.garv.gov.in



અંધકાર થી પ્રકાશ તરફ



નુઆઓન ગામ, બિહાર

જ્યારે ગામડામાં વીજળી નહોતી, ત્યારની સમસ્યાઓને યાદ કરતાં આ ગામનાં રહીશ શ્રી અખિલેશ કુમાર સિંઘ જણાવે છે કે “ઉનાળામાં દિવસ દરમિયાન ઘરે પણ મહિલાઓ અને બાળકોને ગરમીની માઠી અસરનો સામનો કરવો પડતો. તેના સિવાય, રાતે ગામડાનાં જે ભાગોમાં ઓછો પ્રકાશ હોય, ત્યાં સલામતીનો ભય વર્તાતો હતો. બાળકોએ ‘દીભરી’ અથવા કેરોસીનનાં દીવા હેઠળ રાતે ભણવું પડતું. જોકે, જ્યારથી ગામમાં વીજળી આવી છે, ત્યારથી આ બધું જ બદલાઈ ગયું છે. હવે ગરમી થી બચવા માટે ગ્રામજનો પંખા વાપરે છે, રાતનાં સમયની સલામતીમાં પણ વધી ગઈ છે અને બાળકો LED લાઈટો હેઠળ ભણી પણ શકે છે. હવે તો ગામમાં લોટ દળવાની ઘંટીઓ તથા મોટરોનો પણ ઉપયોગ થાય છે.”

બદૌરા ગામ, ઉત્તર પ્રદેશ

એક આનંદિત નિવાસી પોતાની યાદ તાજી કરતાં જણાવે છે કે, “ હું મારા જન્મથી જ અહીં રહું છું. પાછલા દોઢ મહિનાથી અહીં વીજળી આવી છે. આ અંગે આ અગાઉ કંઈ પણ નહોતું થયું. ઘણાં અધિકારીઓ આવેલાં અને વાચદાઓ કરીને ગયેલાં, પણ ત્યાર બાદ ક્યારેય તેઓ દેખાણા પણ નથી. અગાઉ અમે પ્રકાશ માટે કેરોસીનનાં દીવા વાપરતા, પણ હવે અમને હાથ વડે ચાલતાં પંખો તથા હાથ ઘંટીઓ થી છુટકારો મળશે. હવે વીજળી ખેતરો સુધી પણ પહોંચશે. બાળકો રાતે પણ ભણી શકશે. અમારા માટે આ એક મોટી સગવડ છે.”

‘સૌ માટે વીજળી’ 24 x 7

કોલસો: કોલસાની ખાણ થી વીજ મથક સુધી

2014માં માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા જે 204 કોલસાનાં બ્લોકસને રદ કરવામાં આવ્યા હતા, તેમાંથી 31 કોલસાનાં બ્લોકસની પારદર્શક હરાજી અને 43 કોલસાનાં બ્લોકસની ફાળવણી

કોલસો ધરાવતાં રાજ્યોને ખાણથી જીવનકાળ દરમિયાન ₹ 3.44 લાખ કરોડની સંભવિત આવક

2014માં બે તૃતીયાંશ જેટલાં મુખ્ય પાવર પ્લાન્ટ્સ પાસે 7 દિવસ પછાત ઓછો ચાલે, તેટલો ઓછો કોલસાનો જથ્થો હતો. આજે એકપણ પાવર પ્લાન્ટમાં આટલાં જોખમી દરે કોલસાનાં જથ્થાની ઊણપને લગતી સમસ્યા નથી. હાલમાં તેઓ સરેરાશ ધોરણે 25 દિવસ કરતાં વધુનો જથ્થો ધરાવે છે.



નાના તથા મધ્યમ પાયાનાં વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે, કોલસાની કિંમત, તેની ઉપલબ્ધતા અને તેના ઉપયોગ સંબંધી માહિતી પૂરી પાડવા કોલસાની ફાળવણી માટેની નિયંત્રણ સિસ્ટમ [Coal Allocation Monitoring System(CAMS)] પોર્ટલ.



સંશોધન

સંશોધન માટે ડ્રિલિંગમાં 44% નો વધારો. 2012-14માંનાં 12.6 લાખ મીટરની સરખામણી એ 2014-16માં 18.2 લાખ મીટર

ખાણ વિકાસ

દર બે એકર જમીનનાં સંપાદનની સામે એક નોકરી આપવાની આકર્ષક ઓફર જમીનનાં સંપાદનની પ્રક્રિયાને બંને પક્ષો માટે ફાયદાકારક બનાવવામાં આવી



ખાણકામ

2020 સુધીમાં કોલ ઇન્ડિયાનું ઉત્પાદન બે ગણું કરીને તેને 100 કરોડ ટન એ પહોંચાડવું
2015-16માં તેને 53.60 કરોડ ટન ઉત્પાદન કરવામાં આવ્યું
બે વર્ષનાં સમયગાળામાં આ 7.4 % નો ઉમેરો નોંધાવીને, અત્યાર સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન સ્તર સર કર્યું
2010-14 નાં માત્ર 1.8% ની સરખામણી એ 2014-16માં ઉત્પાદનનાં વાર્ષિક દર માં સરેરા 7.7% નો વધારો



ગુણવત્તા

હવે 100% કોલસાનો ભુક્કો વીજળી સંચંત્રોમાં પૂરો પાડવામાં આવશે
2017-18 સુધીમાં વોશરીઝની ક્ષમતા 3.7 કરોડ ટન થી વધીને ચાર ગણી, એટલે કે 15 કરોડ ટન જેટલી થઈ જશે
કોલસાનાં નમૂનાની તૃતીયપક્ષ દ્વારા તપાસ



પરિત્યાગ


નિકાસને મંજૂરી : નવા રેલવે રેકસ તથા રેલવે લાઈનોમાં રોકાણ દ્વારા આધુનિકરણ તથા ચાંત્રીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોલસાનાં નિકાસને પ્રોત્સાહિત કરવા.
મૂળભૂત સુવિધાઓનાં સર્જનને મજબૂત કરવા માટે કોલ ઇન્ડિયા, રેલવે તથા કોલસો ધરાવતાં રાજ્યો, જેમ કે ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢ ની વચ્ચે કરાર (MOUs)



પરિણામ

2015-16માં કોલસાની આયાતમાં ઘટાડો થવાને કારણે 24,000 કરોડ રૂપિયા નાં વિદેશી હૂંડીયામણની બચત.
2016-17 માં ₹ 40,000 કરોડ રૂપિયાનાં વિદેશી હૂંડીયામણની બચત કરવાનો લક્ષ્યાંક


જળવિદ્યુત ઊર્જાને રિચાર્જ કરવા



પાણી ફરીથી વહે છે : ઉત્તર પૂર્વનાં રાજ્યોને સ્વચ્છ વીજળી મળી રહે, તે અંગેની ખાતરી કરવા માટે નાણાંકીય પુનઃ ગોઠવણ દ્વારા ૧,૨૦૦ મેગા વૉટનાં તીસ્તા હાઇડ્રો પ્રોજેક્ટને પુનઃ જીવિત કરવામાં આવ્યો.

ઊર્જા મંત્રાલય હેઠળની નાણાંકીય સંસ્થાઓએ નક્કી કર્યું છે કે તેઓ પાવર પ્રોજેક્ટ્સને લાંબા ગાળાની લોન આપવામાં આવશે, જેનાથી ખાસ કરીને જળશક્તિ આધારિત વીજ નિર્માણની યોજનાઓને મદદ મળી રહેશે.

જળશક્તિ આધારિત વીજળીને પ્રોત્સાહિત કરવા માટેની પ્રશુલ્ક નીતિ



જળશક્તિ આધારિત વીજળીનાં
પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન પૂરું
પાડવા માટે તેમને 2022 સુધી
સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયામાંથી મુક્તિ
આપવામાં આવી

જળ શક્તિ આધારિત યોજનાઓને વિકસાવવામાં
જે ઉચ્ચ મૂડી ખર્ચ, પુનર્વસવાટ તથા પુનઃ સ્થાપન,
ભૂસ્તરશાસ્ત્ર તથા ગભાંધાનનાં સમયગાળા
દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો
હોય છે, તેમનો ઉકેલ લાવવા

લાંબાગાળાનાં PPA કે જેની મર્યાદા
૩૫ વર્ષની હતી, તેમને બીજા ૧૫ વર્ષો
માટે હજી વધારે લંબાવી શકાય તેવા
લાઇસેન્સનાં વિતરણની
પરવાનગી આપવામાં આવી

રાજ્યોને જળશક્તિ આધારિત યોજનાઓને
પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પ્રોત્સાહન
પૂરું પાડવું. જેથી તે યોજનાઓને નીચા દરનાં
પ્રશુલ્કનાં લાભ મળી રહે અને તેને કારણે
રાજ્ય તથા વપરાશકારોને પણ ફાયદો થાય

પાવર જનરેટરો પર
'ટાઇમ ઓફ ધ ડે' મુજબ
પ્રશુલ્ક આપવાની મંજૂરી
જળ દ્વારા વીજળીનાં નિર્માણ થકી
પીકિંગ પાવરનાં વિસ્તારને
પ્રોત્સાહિત કરવા
વિકાસકર્તાઓને સુગમતા રહે તે
માટે અવમૂલ્યન દરમાં તેમને
છૂટ આપવામાં આવી

નવીનીકરણ ખરીદીની ફરજ
(આર. પિ. ઓ.)માંથી જળશક્તિ
આધારિત યોજનાઓ ને મુક્તિ

જળ શક્તિ આધારિત વીજળી પ્રત્યે
વપરાશકારોને આકર્ષવા માટે

વિકાસકર્તાઓને સુગમતા રહે
તે માટે અવમૂલ્યન દરમાં
તેમને છૂટ આપવી

પ્રારંભિક વર્ષોમાં
નીચો પ્રશુલ્ક

ગેસ સંયંત્રોને

પુનઃ સજીવન કરવામાં આવ્યાં



ભારતનાં કુલ 24,150 મેગા વૉટની ગ્રીડ કનેક્ટેડ ક્ષમતા ધરાવતાં પાવર પ્લાન્ટ્સમાંથી 14,305 મેગા વૉટ્સની ક્ષમતા ધરાવતાં 29 ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી 2014માં કોઈ સ્થાનિક ગેસ પુરવઠો પૂરો પાડવામાં નહોતો આવતો.

2015માં પારદર્શક ઇ-હરાજી મારફતે 11,717 મેગા વૉટ્સની ક્ષમતા ધરાવતાં આવા વંચિત પ્લાન્ટ્સમાં ફરીથી રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) ભરીને તેમને પુનર્જીવિત કરવામાં આવ્યાં

પેટીથી મળતાં લાભોમાં વધારો થવાથી આંધ્રપ્રદેશ, કર્નાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા તથા પુડુચેરીને ગેસ આધારિત પ્લાન્ટ્સને કારણે ઉત્પાદનમાં થયેલ વધારાનો ફાયદો મળ્યો

- જે મહિનાઓમાં ઉનાળો ચરમસીમાએ હોય અને પ્રવાહનનાં અવરોધોને કારણે જ્યારે દક્ષિણ ભારતમાં વીજળીની ખેંચ હોય, ત્યારે આનાં થકી વધુ રાહત મળી રહેશે.

ટ્રાન્સમિશન

એક રાષ્ટ્ર, એક વીજસંકલન, એક ભાવ

2014-16નાં સરખામણીએ બે વર્ષ દરમિયાન 50,215 ckm પ્રવાહન લાઈનો નાખવામાં આવી, જે અગાઉનાં બે વર્ષની 33,855 ckm ની સરખામણીએ 1.5 ગણી વધુ તથા અત્યાર સુધીની મહત્તમ છે.

2014-16નાં બે વર્ષનાં સમયગાળામાં સબ સ્ટેશનની ક્ષમતામાં 1,28,403 એમ.વી.એ. નો વધારો નોંધાયો, જે અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.

દક્ષિણ ભારત (આંધ્રપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા તથા પુડુચેરી)ની ૨૦૧૩-૧૪નાં વર્ષમાં જે ૩,૪૫૦ મેગા વૉટની ટ્રાન્સમિશન ક્ષમતા હતી, તેમાં 71% નો વધારો નોંધાયો અને તે ૫,૬૦૦ મેગા વૉટ એ પહોંચી.

આગામી ૩ વર્ષોમાં તેમાં હજુ પણ ૫ ગણા કરતાં વધુનો વધારો જોવા મળશે અને તે ૧૮,૪૦૦ મેગા વૉટ થશે.

પાવર ગ્રીડે 2015-16માં આશરે ₹ 30,300 કરોડની કમીશન્ડ યોજનાઓ શરૂ કરી, જેને કારણે 39% વૃદ્ધિ થવા પામી 2015-16માં આશરે 1 લાખ કરોડની પરીયોજનાઓ શરૂ થઈ.

2015-16માં આશરે 1 લાખ કરોડની પરીયોજનાઓ શરૂ થઈ.

ઉદ્ય સશક્તિકરણ ક્ષેત્રે સુધારણાઓ

ઉજવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજનાએ

વીજ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી વ્યાપક સુધારણાઓ લાવવાની પહેલ કરી છે

વીજ મૂલ્યો ની શ્રુંખલામાં ડિસ્કોમ્સ એ સૌથી નબળી કડી છે.

વાર્ષિક ધોરણે આશરે 60,000 કરોડની ખોટ અને 4.3 લાખ કરોડ રૂપિયાનું સંચિત દેવું.

ડિસ્કોમનાં ભૂતકાળનાં, વર્તમાનનાં તથા ભવિષ્યનાં મુદ્દાઓ અંગેનો કાયમી ઉકેલ નાણાંકીય તથા કાર્ય સંબંધી કાર્યક્ષમતામાં સુધારાઓ લાવીને ડિસ્કોમ્સમાં ઘડમૂળથી ફેરફારો કરવામાં આવ્યાં.

ભૂતકાળ

દેવા અંગેનો હવાલો રાજ્યએ સંભાળ્યો મોટા પાયે નુકસાન

ભવિષ્ય

અંદાજપત્રીય શિસ્ત બુદ્ધિપૂર્વકની આધારરૂપ વ્યવસ્થા

વર્તમાન

નાણાંકીય કાર્યક્ષમતા કામગીરી અંગેની કાર્યક્ષમતા વીજળી પાછળ ઓછો ખર્ચ

સશક્ત તથા ગતિશીલ ડિસ્કોમ

ભારત ઉદ્ય

2015-16માં 1 લાખ કરોડ રૂપિયાનાં ઉદ્ય બોન્ડ જરી કરવામાં આવ્યાં.

18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ જેમાંથી

10 રાજ્યોએ તે કરાર પર હસ્તાક્ષર કરી લીધેલા છે

8 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ જોડાવા માટે સંમત થયા છે.



ટેરિફ નીતિ સૌ માટે વીજળી

અંત્યોદય

સૌને સેવા પૂરી પાડવી

દૂરસ્થ ગામોમાં પણ
માઈક્રોગ્રીડ્સ દ્વારા વીજળી



વ્યાખ્યાયિત બોલી
(DEFINED TRAJECTORY)
થકી બધાંને 24x7
વીજ પુરવઠો



કોલસાનાં વોશરી રીજેક્ટ્સ
પ્રયોગ મારફતે કોલસાની ખાણો
નજીક સસ્તા દરે વીજળી

ગ્રામોદયથી શરૂ કરીને ભારત
ઉદય માટે દીનદયાલ ઉપાધ્યાય
ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY)

શહેરોમાં સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
તૈયાર કરવા ઇન્ટીગ્રેટેડ પાવર
ડેવલપમેન્ટ સ્કીમ (IPDS)

બાકી રહી ગયેલાં **18,452**
ગામો સુધી પણ વીજળી પહોંચાડવી

ગ્રામીણ ઘરો, નાના એકમો તથા નાના અને
કુટીર ઉદ્યોગોન **24 X 7** વીજળીની સુવિધા આપવા માટે
તેમનાં ફીડરો અલગ કરવામાં આવ્યાં.

ખેડૂતોને પૂરતી વીજળી

નવા ટ્રાન્સફોર્મરો નાંખવામાં આવ્યાં અને લાસ્ટ માઈલનાં
આધાર માળખામાં સુધારો કરવામાં આવ્યો.

દૂરસ્થ ગામોને આવરી લેવામાં આવશે:
ઓફગ્રીડ્સ તથા માઈક્રોગ્રીડ્સ દ્વારા

સ્વચ્છ તથા હરિત ઊર્જાને પ્રોત્સાહિત કરવા DISCOMs
દ્વારા સૌર સ્થાપનો (ઇન્સ્ટોલેશન) કરવામાં આવશે.

₹ **75,893** કરોડ ખર્ચ-જોગવાઈ

મંજૂર યોજનાઓ
₹ **73,960** કરોડ

ઘરોમાં સ્માર્ટ મીટરીંગની પદ્ધતિ અપનાવવામાં આવી અને
ગોલમાલ ન થઈ શકે
તેવા મીટરો નાખવામાં આવ્યાં.

શહેરી વિસ્તારોમાં જે માળખાકીય સુધારાઓ કરવામાં આવ્યાં,
તેમાં વ્યાપક પ્રમાણમાં સબ-ટ્રાન્સમિશન તથા
વિતરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં ભૂગર્ભમાં (અન્ડરગ્રાઉન્ડ)
કેબલો તથા GIS પેટા સ્ટેશનો

વપરાશકારોને સારી સેવાઓ
પૂરી પાડવા માટે નો પ્રયોગ

સૌર સ્થાપનો,
જેમાં અગાશી પર રાખવા માટેની સૌર પેનલો પણ સમાવિષ્ટ છે

₹ **65,424** કરોડ ખર્ચ જોગવાઈ


મંજૂર થઈ ચૂકેલ પરિયોજનાઓ

₹ **56,295** કરોડ

સહકારી સમવાયતંત્ર



21 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ જોડાયા છે





વધુ ૧૨ રાજ્યોએ યોજનાને આખરી ઓપ આપી દીધો છે

૩ રાજ્યો આ યોજનાને આખરી ઓપ આપી રહ્યાં છે

વિદ્યુતપ્રવાહ

નાગરિકોનું સશક્તિકરણ




આ એપ્લિકેશન વીજળીનાં દર તથા તેની ઉપલબ્ધતા અંગેની વાસ્તવિક માહિતી પૂરી પાડે છે.

જાણકારી આપીને નાગરિકોનું સશક્તિકરણ

રાજ્ય સરકારોને જવાબદાર બનાવવામાં આવી

www.vidyutpravah.in



પરવડી શકે તેવા વીજળીનાં દર



ટેરિફ નીતિ

ટેરિફનાં દર પોસાઈ શકે
તેવા હોય તે અંગેની
ખાતરી કરવાની ક્ષમતા

₹

હાલના પાવર
પ્લાન્ટ્સમાં જ
વિસ્તરણ કરી
વપરાશકારો નો
વીજ ખર્ચ ઘટાડયો

માંગવામાં ન આવેલી હોય, તેવી
વીજળીનું વેચાણ કરી અને તેમાંથી
મેળવેલ લાભને વહેંચી લેવાની
પરવાનગી આપી કે જેથી વીજળી
પાછળ થતાં એકંદર ખર્ચને ઘટાડી
શકાય.

ટ્રાન્સમિશનને લગતી
યોજનાઓને આગળ ધપાવવા
માટે સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયા
હાથ ધરવામાં આવશે કે જેથી
તે કામગીરી ઓછા ખર્ચે તથા
ઝડપથી પૂર્ણ થયા અંગેની
ખાતરી કરી શકાય

સ્માર્ટ મીટરોનું સ્થાપન
ઝડપથી કરવામાં આવશે,
જેથી “ટાઇમ ઓફ ડે”
મીટરિંગ શક્ય બની શકે,
ચોરી પણ ઘટાડી શકાય
અને નેટ-મીટરિંગ પણ
શક્ય બની શકે.

સમગ્ર ભારતમાંથી વીજળી
મેળવવા માટે ટ્રાન્સમિશન
ક્ષમતાનું નિર્માણ કરી અને
વીજળી પાછળ થતાં ખર્ચને
ઘટાડયો

ટૂંક સમય માટે જો વીજળીની
જરૂરિયાત હોય, તો રાજ્યો
દ્વારા તેને ફરજિયાતપણે હરાજી
મારફતે જ ખરીદી શકાશે.

ઉદ્ય

ડિસ્કોમ્સની મુશ્કેલીઓ દૂર કરવી

ડિસ્કોમ્સથી થતાં નુકસાનને ઘટાડીને
ઓછા દરે વીજળી મેળવવી સંભવિત

ડિસ્કોમ્સનાં દેવા અંગેનો હવાલો સંભાળવામાં આવ્યો અને તેના સરેરાશ વ્યાજદરને 12% માંથી ઘટાડીને 8% કરવામાં આવ્યો

કામગીરી અંગેની કાર્યક્ષમતાને કારણે એકંદરે વાણિજ્ય સંબંધિત તથા ટેકનિકલ (એ. ટી. એન્ડ સી.) નુકસાનમાં ઘટાડો

- મીટરિંગ દ્વારા તથા નુકસાનો અંગેનું પગેરું લેવાથી બિલિંગની કાર્યક્ષમતા સુધારવી
- ઇન્ફ્રા વર્ધન અને સ્માર્ટ મીટરિંગ
- જાહેર ભાગીદારી મારફતે એકત્રીકરણ ક્ષમતા સુધારવી

એકમ દીઠ સ્થિર ખર્ચને ઘટાડવા માટે પ્લાન્ટ લોડ ફેક્ટર વધારવા

સામાન્ય પરિસ્થિતિઓમાં ઘંધામાં 2018-19 સુધીમાં કાર્યક્ષમતામાં સુધારો લાવીને સંભવિત બચત કરી શકાશે



થર્મલની આગેકૂચ

પુરવઠામાં વધારો

ભાવ ઘટાડવા તથા ઓછી કમાણીને કારણે થતી ચોરીઓને ઘટાડવા સ્થાનિક ધોરણે કોલસાનાં પુરવઠામાં વધારો કર્યો

કોલસાનાં વપરાશ સંદર્ભે લવચીકપણું

કાર્યક્ષમ ઉત્પાદન સ્ટેશનોમાં સ્થાનિક કોલસાનાં વપરાશ સંદર્ભે લવચીકપણું, પરિણામે વીજળીનાં ઉત્પાદન પાછળ થતાં ખર્ચમાં ઘટાડો તથા ડિસ્કોમ્સની ખરીદીનો ખર્ચ ઘટ્યો

કોલસા સંદર્ભે જોડાણો

2.3 કરોડ ટનનાં સુયોજન દ્વારા પરિવહન ખર્ચ પેટે ખર્ચાતા વાર્ષિક ₹ 1,371 કરોડની ખચત કરવામાં આવી

કોલસાનો ભાવ

યોગ્ય પ્રશુલ્કની રકમ નક્કી કરવા માટે ગ્રોસ કેલરિફિક વેલ્યુ (GCV) નાં આધારે સુયોજન

2010માં જે સૌર પ્રશુલ્કનાં દર ₹ 16-18 પ્રતિ યુનિટ હતા, તે હવે ઘટાડીને ₹ 4.34-4.67 પ્રતિ યુનિટ કરવામાં આવ્યાં (તેલંગાણામાં જે છેલ્લી બોલી બોલાણી તે મુજબ)

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એન. ટી. પી. સી.) અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસ. ઇ. સી. આઈ.) થકી સૌર પાવરની ખરીદીમાં અન્ય પક્ષ તરફથી જે જોખમ રહેતું હતું, તેમાં ઘટાડો


સૌર પ્લાન્ટ્સને હરિત શ્રેણીને બદલે સફેદ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં જેથી તે સંદર્ભે પર્યાવરણીય મંજૂરીઓ મેળવવી સરળ બને.

બેંકોમાંથી ધિરાણ મેળવવું સરળ બને, તે માટે પુનઃ પ્રાપ્ય ઊર્જા સંબંધી યોજનાઓનો સમાવેશ પ્રાચોરીટી સેક્ટરનાં ધિરાણ ધોરણોમાં કરવામાં આવ્યો

હવે પુનઃપ્રાપ્ય પણ પહોંચની અંદર

ભારતે એલ. ઇ. ડી. (LED) નાં મામલે વૈશ્વિક સ્તરે આગેકૂચ કરી છે

- ભારતે વૈશ્વિક એલઇડી બલ્બ બજારમાં ટોચનું સ્થાન મેળવવા માટે પ્રધાનમંત્રી ઉજલા (Unnat Jyoti by Affordable LEDs for All) યોજના થકી કૂચ કરી છે
- વિશ્વનો સૌથી મોટો LED બલ્બનાં વિતરણનો કાર્યક્રમ, જેમાં 10 કરોડથી વધુ LED બલ્બોનું તો વિતરણ થઇ ચુક્યું છે
- 2019 સુધીમાં 77 કરોડ એવાં બલ્બ કે જે વધુ પડતી વીજળીનો ઉપયોગ કરતાં હોય તેમને બદલવામાં આવશે
- પીક લોડની માંગમાં આશરે 20,000 મેગા વૉટ જેટલો ઘટાડો લાવવામાં આવશે
- વપરાશકારોનાં બીલની રકમમાં આશરે ₹ 40,000 કરોડનો ઘટાડો લાવવામાં આવશે




ઓછા દરે પણ વધુ વોલ્ટેજ 7 વૉટ ને બદલે 9 વૉટ


ઉજલા પર ધ્યાન રાખવું



વિપિન આનંદ,
“અગાઉનાં બલ્બ જલ્દી ખરાબ થતાં હતા અને તે 50 વૉટનાં હતા. ત્યાર બાદ અમે સી. એફ. એલ વાપર્યા, જે 12 વૉટ વીજળીનો ઉપયોગ કરતાં. હવે અમે એલ. ઇ. ડી નો ઉપયોગ કરીએ છીએ, જે માત્ર 7 વૉટ નો જ ઉપયોગ કરે છે. આનાથી નાણાંકીય રીતે અમને ફાયદો થયો છે.”



ચારુ મદાન,
“હું વ્યાવસાયિક ધોરણે એક શિક્ષક તથા ગૃહિણી છું. અગાઉ જ્યારે પણ હું વીજળીનું બીલ ચુકવવા જતી, ત્યારે તેની રકમ વધુ રહેતી. જ્યારથી અમે LED બલ્બ લગાડેલા છે, અમને ફાયદો થયો છે.”




ઉજલા પર દેખરેખ-નિયંત્રણ રાખવા માટેની મોબાઇલ એપ્લિકેશન

www.ujala.gov.in

“ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉત્પાદન ક્ષેત્રે મેગા વૉટમાંથી ગીગા વૉટ તરફ પ્રયાણ કરી રહ્યું છે.”


માનનીય વડાપ્રધાન મંત્રી
શ્રી નરેન્દ્ર મોદી

ભારતનો સંકલ્પ પર્યાવરણ માટે અનુકૂળ હોય તેવી ઊર્જા



વિશ્વનું સ્વચ્છ ઊર્જા માટેનું વડું મથક

2014 માં જે
32 ગીગા વૉટની જે પુનઃ પ્રાપ્યક્ષમતા હતી,
તેમાં 5 ગણથી પણ વધુનો વધારો કરીને
એકંદરે પુનઃપ્રાપ્ય ક્ષમતાને
2022 સુધીમાં 175 ગીગા વૉટ
સુધી પહોંચાડવી છે



ભારત વિશ્વમાં સૌથી મોટા પાયા પર નવીનીકરણ ઊર્જા વિસ્તરણનો કાર્યક્રમ ચલાવી રહ્યું છે.
આબોહવામાં પરિવર્તન લાવવા માટેનો જે સમજૂતી 195 દેશો વચ્ચે પેરીસનાં COP21 ખાતે કરવામાં આવેલો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
2030 સુધીમાં નક્કી કરવામાં આવેલ રાષ્ટ્રીય જ્ઞાણનાં લક્ષ્યાંક (INDC) ની નોંધ લેવી

- 2005ની સરખામણીએ જીડીપીના ઉત્સર્જનનાં સ્તરમાં 33-35% નો ઘટાડો લાવવો
- બિન બળતણ આધારિત ઊર્જા સ્ત્રોતોમાંથી આશરે 40% જેટલાં સંચિત વીજ પાવરને સ્થાપિત કરવા માટેની ક્ષમતા હાંસલ કરવી
- 250-300 કરોડ ટનનાં વધારાનાં કાર્બન સિંકનું નિર્માણ કરવું



આંતરરાષ્ટ્રીય સૌર મૈત્રી-કરાર

વસુદેવ કુટુમ્બકમ

સૌર ઊર્જા સાથે સંવાદિતા સાધવાની મહત્તમ ક્ષમતા ધરાવતાં હોય તેવા 121 ઉષ્ણકટિબંધીય દેશોની વચ્ચે મૈત્રી-કરાર

જે દેશો તેના સભ્ય હોય, તેમાં સૌર ઊર્જાનાં વપરાશ તથા પ્રવર્તનમાં વૃદ્ધિ લાવવા સૌનો સમાન ધ્યેય

2030 સુધીમાં \$1 ટ્રિલિયન (આશરે ₹ 67 કરોડ લાખ) એકત્ર કરી અને તેમનું રોકાણ કરવું



2015 ફરી રોકાણ

વિશ્વમાં સૌથી મોટા પાયાની
પુનઃપ્રાપ્ય નાણાં આપવા માટેની બેઠક

- 2022 સુધીમાં 175 ગીગા વૉટ મેળવવાનાં લક્ષ્યને હાંસલ કરવા
- નવીનીકરણ ઊર્જા માટે ભંડોળ એકત્ર કરવા માટે નવીન ધિરાણ મોડેલો વિકસાવવા



2015માં

42 દેશોનાં 2,860 પ્રતિનિધિઓ

29 દેશોનાં 202 વક્તા

578 ભારતીય અને 124 આંતરરાષ્ટ્રીય કંપનીઓ

7 દેશોના 118 પ્રદર્શકો

નવીનીકરણી ઊર્જા ક્ષેત્રે રોકાણ કરવા જાહેર તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ તૈયાર. તેઓ હરિત ઊર્જા ક્ષેત્ર સંદર્ભે પ્રતિબદ્ધ

266

ગીગા વૉટની
પુનઃપ્રાપ્ય પાવર ક્ષમતા
સંદર્ભે વચનબદ્ધતા

41

ગીગા વૉટની
પુનઃપ્રાપ્ય ઉત્પાદન
પ્રતિબદ્ધતા

વિવિધ યોજનાઓ માટે પુનઃ પ્રાપ્ય ધિરાણ પૂરું પાડવા માટેની ખાતરીઓ

આગામી બેઠક
2015માં

ટકાઉ ભવિષ્ય માટેનું પર્યાવરણ

માર્ચ 2022 સુધીમાં સૌર રિન્યુએબલ પાવર ઓવ્લીગેશન (RPO) માં 8% ની વૃદ્ધિ

નવા થર્મલ તથા કાચા ખનીજનાં પ્લાન્ટ અંગે નવીનીકરણ ઉત્પાદન અંગેની જવાબદારી

સૌર અને પવન ઊર્જા પર કોઈ પ્રકારનો આંતર-રાજ્ય પ્રવાસન વેરો કે કોઈ પ્રકારની ખોટને લગતો વેરો લાગુ પાડવામાં નહીં આવે

ઊર્જા પ્લાન્ટ્સને કચરો પૂરો પાડી અને તેમાંથી 100% ઊર્જા ફરજિયાત પ્રાપ્ત કરવી

નવીનીકરણ ઊર્જા વિસ્તરણ માટેની ગ્રીડ ઓપરેશનની મદદથી આનુષંગિક સેવાઓ પૂરી પાડવા માટે નેશનલ ઓફશોર વિંડ એનર્જી નીતિ

રાષ્ટ્રીય અપતટીય પવન ઊર્જા નીતિ

- દરિયાકિનારાથી 200 નોટીકલ માઈલ દૂર સુધીનાં વિસ્તારમાં

એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નો વિકાસ

- ટૂંક સમયમાં ગુજરાતનાં દરિયા કિનારાથી દૂરનાં વિસ્તારમાં વિકસનાર પ્રથમ યોજના

ઉત્સર્જનમાં ઘટાડો

ક્લીન એનર્જીની યોજનાઓ અને ગંગા કાચાકલ્પમાં ધિરાણ મેળવવામાં સહાયતા મળી રહે, તે માટે સ્વચ્છ પર્યાવરણનાં ઉપકરમાં 8 ગણો વધારો અને તેનો દર પ્રતિ ટન ₹ 50 માંથી ₹ 400 કરવામાં આવ્યો

2014-15 નાં 30.6 લાખની સરખામણીએ 2015-16 માં પુનઃ પ્રાપ્ય ઊર્જાનાં પ્રમાણપત્રો (RECs) નાં વેચાણમાં આશરે 62% નો વધારો

2019 સુધીમાં આશરે 7.9 કરોડ ટન જેટલાં CO₂ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવામાં ઉજાલા સહાયક બની રહેશે



1991થી અત્યાર સુધીમાં

જે કુલ સૌર પંપો નાખવામાં આવેલાં તેની સરખામણીએ 2015-16 માં સૌથી વધુ

31,472 સૌર પંપો આ પંપો લગાડીને ખેડૂતોને મદદ પૂરી પાડવામાં આવી

ઊર્જાની દૃષ્ટિએ કાર્યક્ષમ હોય તેવા LED પંખા અને પંપ સ્થાપિત કરવામાં આવ્યાં

ભવિષ્ય માટેનું રોકાણ

2015-16માં
20,904 મેગા વૉટની
સૌર યોજનાઓ
માટેના ટેન્ડર્સ ભરવામાં આવ્યાં

નવીનીકરણ ઊર્જાનાં ટ્રાન્સમિશનને
મજબૂત બનાવવા માટે
₹ 38,000 કરોડનો
ગ્રીન એનર્જી કોરીડોર
શરૂ કરવામાં આવ્યો.

20 રાજ્યોમાં
20,000 મેગાવૉટની ક્ષમતા ધરાવતાં
33 સૌર પાર્ક્સ શરૂ કરવામાં આવ્યાં

આંધ્રપ્રદેશનાં
અનંતપુરમ ખાતે
વિશ્વની સૌથી મોટી
સૌર યોજના



કુશળ ભારત

સાથે લાંબા ગાળા માટે સંકલિત હોય, તેવી કૌશલ્ય વિકાસ સંબંધિત યોજનાઓ માટે
રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ (એન. એસ. ડી. સી.) અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિધિ
(એન. એસ. ડી. એફ.)

કોલ ઇન્ડિયા

રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાતનાં માળખાં
(NSQF) મુજબનાં તાલીમ કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવ્યું

તેમાં કરાર આધારિત શ્રમિકો,
અર્ધ-કુશળ કામદારોને તથા તેની
સમકક્ષ હોય અથવા તેની સાથે
સંલગ્ન હોય, તેવા ક્ષેત્રો સાથે
જોડાયેલાં યુવાનોને પણ આવરી
લેવામાં આવ્યાં

2.7 લાખ લોકોને
તાલીમ આપવામાં આવશે

એન. ટી. પી. સી.

સમગ્ર દેશમાં નાં 22 સ્થળો પર
5,000 લોકોને પ્રથમ બે વર્ષ
દરમિયાન તાલીમ આપવામાં આવશે

મોડલ તરીકે એક મલ્ટિ-મિશન
કૌશલ સંસ્થાન સ્થાપિત કરવામાં
આવશે

બિહારનાં પછાત વિસ્તારોમાં વસતા
15,000 લોકોને સેવાનાં ક્ષેત્રોમાં
તથા 10,000 લોકોને
ઉત્પાદન ક્ષેત્રે તાલીમ આપવા એક
અન્ય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં
આવ્યાં

2019-20 સુધીમાં સૂર્ય મિત્ર યોજના અંતર્ગત 50,000 સૌર ઇજનેરોને તાલીમ આપવામાં આવશે

જળયુક્ત ભારત

પાણીનાં વ્યવસ્થાપનમાં સુધારો

વિદ્યુત ક્ષેત્રે

પીવા લાયક પાણીની બચત કરવા તથા ગંગા જેવી નદીઓને સ્વચ્છ કરવા, પાવર પ્લાન્ટ્સ ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી અને તેમને ઉપયોગમાં લેતાં હોય છે અને આ રીતે નમામી ગંગેમાં પણ તેઓ પોતાનું યોગદાન આપતાં હોય છે.

Namami
Gange

કોલસાનાં ક્ષેત્રે

ઔદ્યોગિક, સ્થાનિક અને કૃષિ હેતુઓ માટે ખાણનાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે

જળાશયોની જાળવણી

ખાણકામ સમાપ્ત થયા બાદ જે કંઈ પણ ખાલી જગ્યાઓને જળ સંસાધન સ્વરૂપે ભૂગર્ભજળને ફરીથી રિચાર્જ કરવા માટે એમ જ રાખી મુકવામાં આવે છે

દુષ્કાળ સામેની લડાઈ

કોલસાની ખાણો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ભૂગર્ભમાં સંગ્રહિત હોય તેવો પાણીનો પુરવઠો નજીકનાં ગામોને પૂરો પાડીને એક પ્રકારની સહાય પૂરી પાડે છે.

પશ્ચિમી કોલસાનાં ખેતરોએ સાવનેર ભૂગર્ભ ખાણમાંથી પાણી છોડીને તેને નાગપુર જિલ્લાનાં બોરગામ નામનાં એક દુષ્કાળગ્રસ્ત ગામડા સુધી પહોંચાડવામાં આવે છે, અને તેનાં કારણે જળનાં સ્તરમાં વૃદ્ધિ થાય છે.

ઓક્ટોબર 2015થી પશ્ચિમી કોલસાનાં ક્ષેત્ર કાશ્મી કે જે એક ખુલ્લી ખાણ છે, તે કાન્હન ટાઉનશીપ કે જ્યાં પાણીની ઊણપ છે, ત્યાં પાણી પહોંચાડી રહ્યું છે અને તેની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરે છે.



एक कदम स्वच्छता की ओर

સ્વચ્છ ભારત

ત્રણ મંત્રાલયો હેઠળનાં PSUs એ સક્રિય રીતે (ખાસ કરીને બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ તથા રાજસ્થાન જેવા રાજ્યોમાંના) કામગીરી કરીને શાળાએ જતાં છોકરાઓ તથા છોકરીઓ માટે 1,28,000 શૌચાલયોનું નિર્માણ કર્યું

PSUs 5 વર્ષ સુધી શૌચાલયોની જાળવણી કરશે, જેથી તેમનો ઉપયોગ અને જાળવણી સુનિશ્ચિત કરી શકાય

ગ્રામીણ સમુદાયોમાં સ્વચ્છતાની સ્થિતિ વધારે સુધારવા જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે



ઘકો-દુરીઝમ અતુલ્ય ભારત

પશ્ચિમી કોલ ફિલ્ડ્સ દ્વારા નાગપુર નજીક એક અનન્ય ઘકો-પાર્ક વિકસાવવામાં આવ્યો



ખાણ કામ સંબંધિત પ્રવૃત્તિઓ દેખાડવા માટે ગોડેગામની ખુલ્લી ખાણ તથા સાવનેરની ભૂગર્ભ ખાણની મુલાકાત

ત્યાંનાં મુખ્ય આકર્ષણો

- માર્ગદર્શન સાથે ખાણકામની પ્રવૃત્તિઓ દર્શાવતો એક પ્રવાસ
- એક રમકડાંની રેલગાડીમાં વન સફારી

રમતગમત

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા રમતગમતને પ્રોત્સાહિત કરવામાં કોલ ઇન્ડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા

હાલમાં રાંચીનાં હોત્યાર ખાતે જે વૈશ્વિક કક્ષાનું સ્ટેડીયમ/માળખું છે, તેમાં સ્પોર્ટ્સ એકેડમી તથા સ્પોર્ટ્સ યુનીવર્સિટીની રચના કરવા અંગે ઝારખંડ સરકાર સાથે સમજૂતીકરાર પર હસ્તાક્ષર કર્યા હતા

ભવિષ્યની યોજનાઓ

- હોકી માટેનું શ્રેષ્ઠતા કેન્દ્ર, ઓરિસ્સાનાં સુંદરગઢ ખાતે
- મધ્યપ્રદેશના સિંગરૌલીમાં કસરત અકાદમી





વીજળી, કોલસો અને નવીન તથા પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય
ભારત સરકાર

“ આપણને સ્વતંત્રતા મળ્યાને આટલા વર્ષો વીતી ગયાં હોવા છતાં, હજી પણ ૧૮,૦૦૦ ગામડાંઓ એવાં છે કે જ્યાં વીજળીનાં થાંભલા કે વીજળીનાં તાર સુધ્યાં પહોંચ્યા નથી. આ ૧૮,૦૦૦ ગામડાઓનાં લોકોને ૧૮મી સદીમાં જે મુજબ હતી, તેવી જ જિંદગી ૨૧મી સદીમાં પણ વિતાવવી પડી રહી છે અને તે તેમની મજબૂરી છે. તો મારા પ્રિય ભાઈઓ અને બહેનો તમે જ મને જણાવો કે ગરીબીનાં નામ પર રાજનીતિ કરવાવાળાઓ એ આ અંગે શું પગલાં ભર્યાં છે? તેમણે આ ૧૮,૦૦૦ ગામડાઓ સુધી વીજળી હજી પણ કેમ નથી પહોંચાડી? મેં આ કાર્ય કરવા અંગેનું બીડું ઝડપ્યું છે. ૧૫મી ઓગસ્ટને દિવસે મેં એવી જાહેરાત કરી છે કે ૧૦૦૦ દિવસોમાં, હું તે ૧૮,૦૦૦ ગામડાઓમાં વીજળી પહોંચાડીશ. હું દરરોજનો હિસાબ મારા દેશનાં નાગરિકોને આપું છું. ”

માનનીય વડા પ્રધાન
શ્રી નરેન્દ્ર મોદી

www.ujwalbharat.gov.in



@UjwalBharat